



BIGBLOC CONSTRUCTION LIMITED

CIN NO. : L45200GJ2015PLC083577

Regd. Off. : 601-B, 'A' Wing, International Trade Centre, Majura Gate, Ring Road, Surat-395 002.

(Ph.) : +91-261-2463261, 2463262, 2463263, 3234330 (F) : +91-261-2463264

(E) : contact@nxtbloc.in Visit us : www.nxtbloc.in



NXTBLOC[®]
Autoclaved Aerated Concrete Blocks

1st September, 2021

To, Department of Corporate Service, Bombay Stock Exchange Limited, 1 st Floor, Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Mumbai-400001 Script Code: 540061 ISIN : INE412U01017	To, Listing Department, National Stock Exchange of India Limited, Exchange Plaza, C-1, BLOCK G, Bandra-Kurla Complex, Bandra (E) Mumbai- 400051 Symbol: BIGBLOC ISIN : INE412U01017
--	--

Sub: COPY OF NEWSPAPER ADVERTISEMENT IN RESPECT OF NOTICE OF 6TH ANNUAL GENERAL MEETING, REMOTE E-VOTING INFORMATION, BOOK CLOSURE AND SUB-DIVISION / SPLIT OF EQUITY SHARES

Dear Sir,

Pursuant to the Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we are submitting herewith a copy of newspaper clipping in respect of Notice of 6th Annual General Meeting, Remote e-voting information, Book closure and sub-division/split of equity shares published in the following Newspapers on 1st September, 2021.

- "Financial Express" all India edition English Newspaper.
- "Financial Express"- Ahmedabad - a regional language (i.e. Gujarati) Newspaper.

Please take the above on your record.

Thanking You

FOR BIGBLOC CONSTRUCTION LIMITED

S. B. Kapadia

Shyam Kapadia
Company Secretary & Compliance Officer
ACS – 55158



Encl.: As Above

From the Front Page

SHIVA CEMENT LIMITED
 CIN: L26200RJ198PLC021557
 Regd Office: Shiva Cement Limited, Plot No. 10, Sector-10, Gurgaon, Haryana, India.
 Dist:Gurgaon, State: Haryana. E-mail: investor@shivacement.com

NOTICE OF 35th ANNUAL GENERAL MEETING, REMOTE E-VOTING INFORMATION AND BOOK CLOSURES DATES

NOTICE is hereby given that 35th Annual General Meeting of Shiva Cement Limited will be held on Thursday, the 23rd September, 2021 at 10:00 AM (IST) at the Auditor's Office, Shiva Cement Limited, Plot No. 10, Sector-10, Gurgaon, Haryana. The business to be transacted at the AGM is as follows:

In view of the ongoing COVID-19 pandemic, social distancing norm to be followed and the continuing impact of the movement of persons in various parts of the country and in order to ensure the safety of the members of the Company, the AGM will be held through Video Conferencing (VC)/Other Audio-Visual Means (OAVM) facility. The AGM will be held on Thursday, the 23rd September, 2021 at 10:00 AM (IST) at the Auditor's Office, Shiva Cement Limited, Plot No. 10, Sector-10, Gurgaon, Haryana. The business to be transacted at the AGM is as follows:

1. To receive and consider the Audited Financial Statements for the financial year ended on 31st March, 2021 along with the Report of the Auditors thereon.

2. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

3. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

4. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

5. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

6. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

7. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

8. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

9. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

10. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

11. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

12. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

13. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

14. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

15. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

16. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

17. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

18. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

19. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

20. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

21. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

22. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

23. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

24. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

25. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

26. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

27. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

28. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

29. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

30. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

31. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

32. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

33. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

34. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

35. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

36. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

37. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

38. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

39. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

40. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

41. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

42. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

43. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

44. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

45. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

46. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

47. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

48. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

49. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

50. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

51. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

52. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

53. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

54. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

55. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

56. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

57. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

58. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

59. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

60. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

61. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

62. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

63. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

64. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

65. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

66. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

67. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

68. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

69. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

70. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

71. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

72. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

73. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

74. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

75. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

76. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

77. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

78. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

79. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

80. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

81. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

82. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

83. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

84. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

85. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

86. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

87. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

88. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

89. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

90. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

91. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

92. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

93. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

94. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

95. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

96. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

97. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

98. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

99. To receive and consider the Report of the Auditors for the financial year ended on 31st March, 2021.

100. To receive and consider the Report of the Directors for the financial year ended on 31st March, 2021.

Working to enable global settlement of G-secs: Das

The governor said as part of the road map for the gradual restoration of the variable rate reverse repo (VRRR) auction as the main operation under the revised liquidity management framework, RBI will continue to conduct 'netting operations' from time to time as needed. This will be aimed at facilitating the process of markets settling down to regular timings and functioning and the normalisation of liquidity operations. The process will help manage unanticipated flows so that liquidity flows so that liquid conditions in the system evolve in a balanced and evenly distributed manner, Das said.

He emphasised the need to develop a yield curve that is liquid across terms, observing that secondary market liquidity, as measured by turnover ratio, is found to be relatively low on several occasions. It also tends to remain concentrated in a few securities and tenors. "The yield curve accordingly displays kinks, reflecting liquidity premium commanded by select securities or tenors. To a certain extent, this is a result of the market microstructure in India, dominated as it is by buy-and-hold and long-only investors," Das said.

The governor said liquidity in the g-sec markets tends to dry up during periods of rising interest rates or in times of uncertainty. While the market for special repo facilitates borrowing of securities, it is worthwhile to consider other alternatives that ensure adequate supply of securities to meet the needs of the entire spectrum of maturities, Das said.

He referred to past discussions on the introduction of securities lending and borrowing mechanism (SLBM). They were held with a view to augment secondary market liquidity by incentivising buy-and-hold-type investors such as insurance companies and pension funds to make available their securities to other market participants. Das urged for a continuation of discussions on the matter as part of overall market development.

Das said this is an opportune time to consider new instruments to facilitate hedging of long-term interest rate and reinvestment risk by market participants such as insurance companies, provident funds, pension funds and corporates. "The interest rate derivatives (IRD) market has developed over the years with the availability of a wide range of products. The major liquid product, however, continues to be the Mumbai Interbank Offer Rate (MIBOR) based Overnight Indexed Swap (OIS) market," Das said, adding, "Participation in the IRD markets is also largely limited to foreign banks, private sector banks and primary dealers."

In this regard, he appreciated RBI's formulation of operational guidelines for trade in swaptions, which has now commenced. "On its part, the Reserve Bank of India will endeavour to ensure adequate liquidity in the swap market as an integral element of its effort to maintain comfortable liquidity conditions in the system," Das said.

ABHAY OSWAL GROUP

Oswal Agro Mills Limited
 CIN: L12318P9179PLC012667
 Corporate Office: 7th Floor, Antriksh Bhawan, 22, Kasturba Gandhi Marg, New Delhi-110001

INFORMATION REGARDING 41st ANNUAL GENERAL MEETING TO BE HELD THROUGH VIDEO CONFERRING/ OTHER AUDIO VISUAL MEANS

NOTICE is hereby given that the 41st Annual General Meeting ("AGM") of Oswal Agro Mills Limited ("the Company") is scheduled to be held on Friday, September 24, 2021 at 12:30 PM (IST) through Video Conferencing ("VC")/Other Audio-Visual Means ("OAVM") facility to transact the businesses as set out in the Notice of AGM. In view of continuing pandemic, social distancing is a pre-requisite that needs to be followed. Ministry of Corporate Affairs (MCA) vide circular Nos. 02/2021, 14/2020, 17/2020 and 20/2020 dated January 13, 2021, April 8, 2020, April 13, 2020 and May 20, 2020 respectively (MCA Circulars) and Securities and Exchange Board of India (SEBI) vide Circular No. SEBI/HO/CFD/CMD/IR/2021/11 and SEBI/HO/CFD/CMD/IR/2020/79 dated January 15, 2021 and May 12, 2020 respectively (SEBI Circulars) have permitted the holding of AGM through VCOAVM.

In accordance with the aforesaid circulars, electronic copies of the Notice of AGM and the Annual Report of the Company for the financial year 2020-21 will be sent to all the members of the Company whose email addresses are registered with the Company or the Depositories/Depository Participants. Members may please note that these documents will also be available on the Company's website (www.oswalagro.com).

Stock Exchange website-BSE Limited (www.bseindia.com) and National Stock Exchange of India Limited (www.nseindia.com) and the website of NSDL Appointee (www.evoting.nsdl.com) facility at www.evoting.nsdl.com. Members can attend and participate in the AGM through VC/OAVM facility only. Members attending the meeting through VC/OAVM shall be counted for the purpose of reckoning the quorum as per section 103 of the Companies Act, 2013 and for the purpose of reckoning for joining the AGM as provided in the notice of the AGM.

The Company is providing remote e-voting facility ("Remote e-voting") to all its members to cast their votes on all resolutions as set out in the notice of the AGM. Additionally, the Company is providing the facility of voting through e-voting system during the AGM ("e-voting"). Detailed procedure for remote e-voting/e-voting is provided in the Notice of the AGM.

Members may note that: (a) the remote e-voting mode shall be available to all the members of the Company whose email addresses are registered with the Company or the Depositories/Depository Participants. The same are also available on the Company's website (www.oswalagro.com).

Members may note that: (a) the remote e-voting mode shall be available to all the members of the Company whose email addresses are registered with the Company or the Depositories/Depository Participants. The same are also available on the Company's website (www.oswalagro.com).

Members may note that: (a) the remote e-voting mode shall be available to all the members of the Company whose email addresses are registered with the Company or the Depositories/Depository Participants. The same are also available on the Company's website (www.oswalagro.com).

Members may note that: (a) the remote e-voting mode shall be available to all the members of the Company whose email addresses are registered with the Company or the Depositories/Depository Participants. The same are also available on the Company's website (www.oswalagro.com).

Members may note that: (a) the remote e-voting mode shall be available to all the members of the Company whose email addresses are registered with the Company or the Depositories/Depository Participants. The same are also available on the Company's website (www.oswalagro.com).

Members may note that: (a) the remote e-voting mode shall be available to all the members of the Company whose email addresses are registered with the Company or the Depositories/Depository Participants. The same are also available on the Company's website (www.oswalagro.com).

Members may note that: (a) the remote e-voting mode shall be available to all the members of the Company whose email addresses are registered with the Company or the Depositories/Depository Participants. The same are also available on the Company's website (www.oswalagro.com).

Members may note that: (a) the remote e-voting mode shall be available to all the members of the Company whose email addresses are registered with the Company or the Depositories/Depository Participants. The same are also available on the Company's website (www.oswalagro.com).

Members may note that: (a) the remote e-voting mode shall be available to all the members of the Company whose email addresses are registered with the Company or the Depositories/Depository Participants. The same are also available on the Company's website (www.oswalagro.com).

Members may note that: (a) the remote e-voting mode shall be available to all the members of the Company whose email addresses are registered with the Company or the Depositories/Depository Participants. The same are also available on the Company's website (www.oswalagro.com).

Members may note that: (a) the remote e-voting mode shall be available to all the members of the Company whose email addresses are registered with the Company or the Depositories/Depository Participants. The same are also available on the Company's website (www.oswalagro.com).

Members may note that: (a) the remote e-voting mode shall be available to all the members of the Company whose email addresses are registered with the Company or the Depositories/Depository Participants. The same are also available on the Company's website (www.oswalagro.com).

Members may note that: (a) the remote e-voting mode shall be available to all the members of the Company whose email addresses are registered with the Company or the Depositories/Depository Participants. The same are also available on the Company's website (www.oswalagro.com).

Members may note that: (a) the remote e-voting mode shall be available to all the members of the Company whose email addresses are registered with the Company or the Depositories/Depository Participants. The same are also available on the Company's website (www.oswalagro.com).

Members may note that: (a) the remote e-voting mode shall be available to all the members of the Company whose email addresses are registered with the Company or the Depositories/Depository Participants. The same are also available on the Company's website (www.oswalagro.com).

Members may note that: (a) the remote e-voting mode shall be available to all the members of the Company whose email addresses are registered with the Company or the Depositories/Depository Participants. The same are also available on the Company's website (www.oswalagro.com).

Members may note that: (a) the remote e-voting mode shall be available to all the members of the Company whose email addresses are registered with the Company or the Depositories/Depository Participants. The same are also available on the Company's website (www.oswalagro.com).

Members may note that: (a) the remote e-voting mode shall be available to all the members of the Company whose email addresses are registered with the Company or the Depositories/Depository Participants. The same are also available on the Company's website (www.oswalagro.com).

SC: Supertech's twin towers to be razed

Upholding the 2014 order of the Allahabad High Court that ordered demolition of the illegal construction, a bench comprising justices DY Chandrachud and MR Shah accepted the HC's findings that the sanction given to the twin towers by the Noida Authority in 2019 was illegal. The towers violated fire safety norms, national building code and minimum distance requirement between individual buildings as well as the contractual obligation to provide towers to the residents of the housing society.

The judges said the approval to the two towers was a result of "collusion" between Noida civic authorities and the real estate company.

The judges said no effort to ensure compliance of the UP Apartments Act 2010, as a result of which the rights of the flat purchasers have been brazenly violated. This cannot point to any conclusion, other than the collusion between Noida civic authorities and the real estate company.

The judges said no effort to ensure compliance of the UP Apartments Act 2010, as a result of which the rights of the flat purchasers have been brazenly violated. This cannot point to any conclusion, other than the collusion between Noida civic authorities and the real estate company.

The judges said no effort to ensure compliance of the UP Apartments Act 2010, as a result of which the rights of the flat purchasers have been brazenly violated. This cannot point to any conclusion, other than the collusion between Noida civic authorities and the real estate company.

The judges said no effort to ensure compliance of the UP Apartments Act 2010, as a result of which the rights of the flat purchasers have been brazenly violated. This cannot point to any conclusion, other than the collusion between Noida civic authorities and the real estate company.

The judges said no effort to ensure compliance of the UP Apartments Act 2010, as a result of which the rights of the flat purchasers have been brazenly violated. This cannot point to any conclusion, other than the collusion between Noida civic authorities and the real estate company.

The judges said no effort to ensure compliance of the UP Apartments Act 2010, as a result of which the rights of the flat purchasers have been brazenly violated. This cannot point to any conclusion, other than the collusion between Noida civic authorities and the real estate company.

The judges said no effort to ensure compliance of the UP Apartments Act 2010, as a result of which the rights of the flat purchasers have been brazenly violated. This cannot point to any conclusion, other than the collusion between Noida civic authorities and the real estate company.

The judges said no effort to ensure compliance of the UP Apartments Act 2010, as a result of which the rights of the flat purchasers have been brazenly violated. This cannot point to any conclusion, other than the collusion between Noida civic authorities and the real estate company.

The judges said no effort to ensure compliance of the UP Apartments Act 2010, as a result of which the rights of the flat purchasers have been brazenly violated. This cannot point to any conclusion, other than the collusion between Noida civic authorities and the real estate company.

The judges said no effort to ensure compliance of the UP Apartments Act 2010, as a result of which the rights of the flat purchasers have been brazenly violated. This cannot point to any conclusion, other than the collusion between Noida civic authorities and the real estate company.

The judges said no effort to ensure compliance of the UP Apartments Act 2010, as a result of which the rights of the flat purchasers have been brazenly violated. This cannot point to any conclusion, other than the collusion between Noida civic authorities and the real estate company.

The judges said no effort to ensure compliance of the UP Apartments Act 2010, as a result of which the rights of the flat purchasers have been brazenly violated. This cannot point to any conclusion, other than the collusion between Noida civic authorities and the real estate company.

The judges said no effort to ensure compliance of the UP Apartments Act 2010, as a result of which the rights of the flat purchasers have been brazenly violated. This cannot point to any conclusion, other than the collusion between Noida civic authorities and the real estate company.

The judges said no effort to ensure compliance of the UP Apartments Act 2010, as a result of which the rights of the flat purchasers have been brazenly violated. This cannot point to any conclusion, other than the collusion between Noida civic authorities and the real estate company.

The judges said no effort to ensure compliance of the UP Apartments Act 2010, as a result of which the rights of the flat purchasers have been brazenly violated. This cannot point to any conclusion, other than the collusion between Noida civic authorities and the real estate company.

The judges said no effort to ensure compliance of the UP Apartments Act 2010, as a result of which the rights of the flat purchasers have been brazenly violated. This cannot point to any conclusion, other than the collusion between Noida civic authorities and the real estate company.

The judges said no effort to ensure compliance of the UP Apartments Act 2010, as a result of which the rights of the flat purchasers have been brazenly violated. This cannot point to any conclusion, other than the collusion between Noida civic authorities and the real estate company.

The judges said no effort to ensure compliance of the UP Apartments Act 2010, as a result of which the rights of the flat purchasers have been brazenly violated. This cannot point to any conclusion, other than the collusion between Noida civic authorities and the real estate company.

The judges said no effort to ensure compliance of the UP Apartments Act 2010, as a result of which the rights of the flat purchasers have been brazenly violated. This cannot point to any conclusion, other than the collusion between Noida civic authorities and the real estate company.

The judges said no effort to ensure compliance of the UP Apartments Act 2010, as a result of which the rights of the flat purchasers have been brazenly violated. This cannot point to any conclusion, other than the collusion between Noida civic authorities and the real estate company.

The judges said no effort to ensure compliance of the UP Apartments Act 2010, as a result of which the rights of the flat purchasers have been brazenly violated. This cannot point to any conclusion, other than the collusion between Noida civic authorities and the real estate company.

The judges said no effort to ensure compliance of the UP Apartments Act 2010, as a result of which the rights of the flat purchasers have been brazenly violated. This cannot point to any conclusion, other than the collusion between Noida civic authorities and the real estate company.

The judges said no effort to ensure compliance of the UP Apartments Act 2010, as a result of which the rights of the flat purchasers have been brazenly violated. This cannot point to any conclusion, other than the collusion between Noida civic authorities and the real estate company.

The judges said no effort to ensure compliance of the UP Apartments Act 2010, as a result of which the rights of the flat purchasers have been brazenly violated. This cannot point to any conclusion, other than the collusion between Noida civic authorities and the real estate company.

MADRAS FERTILIZERS LIMITED

(A Government of India Undertaking)
 CIN - L32201 TN1966GO005469
 Regd. Office: Manali, Chennai 600 068.
 Tel No: 25942221/25945488/25945203 Website: www.madrasfert.co.in
 e-mail: csc@madrasfert.co.in / cosec@madrasfert.co.in

NOTICE

Members are hereby informed that the 55th Annual General Meeting (AGM) of the Company will be held on 20th September 2021 at 11.00 a.m. (IST) through Video Conferencing ("VC")/Other Audio Visual Means ("OAVM"), in conformity with the Ministry of Corporate Affairs (MCA) General Circulars No.02/2021 dated 13th January 2021 and 20/2020 dated 15th May 2020 read with Securities and Exchange Board of India (SEBI) Circular No. SEBI/HO/CFD/CMD/IR/2021/11 dated 15th January 2021 in view of the ongoing COVID-19 pandemic.

In accordance with the aforesaid circulars, electronic copies of the Notice of AGM and the Annual Report for the financial year 2020-21 will be sent to all the members of the Company whose email addresses are registered with the Company or the Depositories/Depository Participants. The same are also available on the Company's website (www.madrasfert.co.in) and the website of NSDL Appointee (www.evoting.nsdl.com).

The Company is providing remote e-voting facility ("Remote e-voting") to all its members to cast their votes on all resolutions as set out in the notice of the AGM. Additionally, the Company is providing the facility of voting through e-voting system during the AGM ("e-voting"). Detailed procedure for remote e-voting/e-voting is provided in the Notice of the AGM.

Members may note that: (a) the remote e-voting mode shall be available to all the members of the Company whose email addresses are registered with the Company or the Depositories/Depository Participants. The same are also available on the Company's website (www.madrasfert.co.in).

Members may note that: (a) the remote e-voting mode shall be available to all the members of the Company whose email addresses are registered with the Company or the Depositories/Depository Participants. The same are also available on the Company's website (www.madrasfert.co.in).

Members may note that: (a) the remote e-voting mode shall be available to all the members of the Company whose email addresses are registered with the Company or the Depositories/Depository Participants. The same are also available on the Company's website (www.madrasfert.co.in).

Members may note that: (a) the remote e-voting mode shall be available to all the members of the Company whose email addresses are registered with the Company or the Depositories/Depository Participants. The same are also available on the Company's website (www.madrasfert.co.in).

Members may note that: (a) the remote e-voting mode shall be available to all the members of the Company whose email addresses are registered with the Company or the Depositories/Depository Participants. The same are also available on the Company's website (www.madrasfert.co.in).

Members may note that: (a) the remote e-voting mode shall be available to all the members of the Company whose email addresses are registered with the Company or the Depositories/Depository Participants. The same are also available on the Company's website (www.madrasfert.co.in).

Members may note that: (a) the remote e-v

